

પ્રદૂષણના કારણે લકવાના હુમલાનું પ્રમાણ 40 ટકા થયું

70 ટકા પ્રદૂષણ વાહનોને આભારી

પ્રદૂષણની માઠી અસરો પર પ્રકાશ પાડતા ડો.ભૂપેશ શાહે કહ્યું કે



સિટી રિપોર્ટર @ahm_cb

વાહનોના કારણે થતા પ્રદૂષણ વિશે વાત કરતા ડો.ભૂપેશ શાહે કહ્યું કે, 'અમદાવાદ શહેરમાં 70 ટકા પ્રદૂષણ વાહનોને આભારી છે. વાહનોમાંથી નિકળતો કાર્બન મોનોક્સાઈડ હૃદયરોગના હુમલા માટે પ્રત્યક્ષ રીતે જવાબદાર છે.'

સિટીમાંપાર્ટીક્યુલરનું પ્રમાણ વધ્યું

ડો.ભૂપેશ શાહના જણાવ્યા અનુસાર અમદાવાદમાં અતિજોખમી એવા પાર્ટીક્યુલર મેટરનું પ્રમાણ 2.5થી 10મીલી માઈક્રોન સુધી હવામાં જોવા મળે છે. વળી અમદાવાદના ભૂગર્ભ જળમાં પેસ્ટિસાઈડનું પ્રમાણ 51 ટકા જેટલું જેવા મળે છે. પેસ્ટિસાઈડવાળું પાણી પિવાના કારણે કેન્સર અને વંધત્વ જેવી સમસ્યાઓ આકાર લે છે.

સતતવાહનોના અવર-જવરથી ઘબકતા અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધ્યું છે કે હવે માણસોના હૃદયને ઘબકારા લેવા મુશ્કેલ બન્યા છે. પ્રદૂષણની સીધી કે આડકતરી અસરો સીધી શહેરીજનોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે. જે બાબતને કેન્દ્રમાં રાખી શહેરની એસસીજી હોસ્પિટલ દ્વારા 'પ્રદૂષણની સ્વાસ્થ્ય પર થતી આડ-અસરો' વિષય પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હૃદયરોગના અને કેન્સરના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા પ્રદૂષણની માનવ શરીર પર થતી અસરો પર ચર્ચા કરી હતી.

ડો. ભૂપેશ.ડી શાહ દ્વારા પ્રદૂષણની હૃદય પર થતી આડ-અસરો પર સંવાદ કર્યો હતો. જેમા તેમણે કહ્યું કે, 'પ્રદૂષણની સીધી અસર હૃદય અને ફેફસા પર થાય છે. પ્રદૂષણના કારણે હાર્ટએટેક અને હૃદયના ઘબકારા વધવાની કે ઘટવાની તકલીફ પડે છે. ફેફસાને પ્રદૂષણના કારણે એર્લજી, અસ્થમાં, કેન્સર જેવા ગંભીર પ્રકારના રોગો થઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદૂષણના કારણે લકવાનો હુમલાનું પ્રમાણ 40 ટકા થયું છે.' જ્યારે ડો. હંસલ ભચેચ દ્વારા 'માનસિક પ્રદૂષણ' વિષય પર ઓડિયન્સ સાથે ટોક કર્યો હતો. ડો.કૌસ્તુભ પટેલે 'પ્રદૂષણ લાવે કેન્સરનું દૂષણ', ડો.પાર્થિવ મહેતાએ 'ચતુરજન કરે વાયુ રાક્ષસને મ્હાત' અને ડો. ઉર્મિન ધ્રુવે 'પ્રદૂષણની મગજ પર આડઅસરો' પર વાત કરી હતી. એએમએ ખાતે એસસીજી હોસ્પિટલ દ્વારા 'પ્રદૂષણની સ્વાસ્થ્ય પર થતી આડ-અસરો' પર ડો. ભૂપેશ.ડી શાહના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.